



માનવ તસ્કરી અને ગુલામી

માનવ તસ્કરી અને ગુલામી એ ઓસ્ટ્રેલિયામાં ગંભીર ગુના છે.

માનવ તસ્કરી અને ગુલામી કાયદાની વિરુદ્ધ છે.

આવા ગુના કરનાર વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, તેને જેલની સજા થઈ શકે છે.

જો તમે કે તમારી ઓળખીતી વ્યક્તિ જોખમમાં હોય તો ૦૦૦ પર પોલીસને ફોન કરો.

ઓસ્ટ્રેલિયામાં પોલીસ પાસે જવું સલામત છે અને તેમના પર વિશ્વાસ કરી શકાય છે.

જો તમારે મફત દુભાષિયા સેવાની જરૂર હોય તો 131 450 પર ફોન કરો.

ઓસ્ટ્રેલિયાની સરકાર કોઈપણ સંજોગોમાં માનવ તસ્કરી અથવા આધુનિક ગુલામી ચલાવી લેતી નથી.

જ્યારે લોકો બીજી વ્યક્તિના લાભ માટે શોષણકારક પરિસ્થિતિઓમાં મુકાય છે ત્યારે માનવ તસ્કરી અથવા ગુલામી થવા પામે છે. તે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સાથે થઈ શકે છે. માનવ તસ્કરી અને ગુલામીમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:

- પરોણાગત, બાંધકામ, વનનિર્માણ, ખાણ અથવા ખેતી જેવા ઉદ્યોગોમાં, તેમજ ગાઢ સંબંધોમાં થતી ગુલામી, દાસત્વ અથવા પરાણે કરાવાતી મજૂરી;
- દેવાનું બંધન;
- જાતીય શોષણ;
- બળજબરીપૂર્વકનાં લગ્ન; અથવા
- અંગ કાઢી લેવાના હેતુ માટે તસ્કરી.

માનવ તસ્કરી અને ગુલામી એ છૂપા ગુના છે.

માનવ તસ્કરી અને ગુલામી એવા ગુના છે જે પકડી પાડવા મુશ્કેલ હોઈ શકે છે. લોકો મદદ ન પણ માગે કારણ કે તેમને બીક હોય છે કે તેમનું શોષણ કરનારા બદલો લેશે અથવા તેઓ તેમનું માઇગ્રેશન સ્ટેટસ ગુમાવશે.

કોઈ વ્યક્તિની તસ્કરી થઈ રહી છે તેવું સૂચવતા સંકેતોમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે કે જ્યાં:

- વ્યક્તિ પર કામ કરવા માટે જબરદસ્તી અથવા બળજબરી કરવામાં આવતી હોય કે ધમકી આપવામાં આવતી હોય;
- વ્યક્તિ ખરાબ પરિસ્થિતિઓમાં કામ કરતી હોય;

- વ્યક્તિને તેના નોકરી પર રાખનાર વ્યક્તિ અથવા ત્રીજા પક્ષકાર તરફથી ચૂકવણી કરાતી ન હોય અથવા વ્યક્તિ મોટા દેવાની પરત ચૂકવણી કરતી હોવાનું જણાતું હોય; અથવા
- વ્યક્તિનો પાસપોર્ટ અથવા બીજા અંગત દસ્તાવેજો ત્રીજા પક્ષકારના કબજામાં હોય, અને વ્યક્તિને જરૂર પડે ત્યારે આ દસ્તાવેજો પ્રાપ્ત કરી શકતી ન હોય.

શું તમે કે તમારું કોઈ ઓળખીતું જોખમમાં છે?

જો તમે કે તમારું કોઈ ઓળખીતું ગુલામી અથવા માનવ તસ્કરીમાં હોય અથવા તેના જોખમમાં હોય, તો તમે **131 237** (131AFP) પર ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (**Australian Federal Police**) (AFP) નો સંપર્ક કરી શકો છો અથવા મદદ માટે **www.afp.gov.au** પર **AFP** ની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. AFP તમને સલામત રાખી શકે, સલાહ આપી શકે અને મદદ માટે અન્ય સેવાઓ તરફ દોરી શકે છે જેમ કે રહેવાની વ્યવસ્થા, નાણાકીય મદદ, સલાહ અને કાયદાકીય અને ઇમિગ્રેશન બાબતે સલાહ.

માનવ તસ્કરી અથવા ગુલામીનો ભોગ બનનાર લોકોને મદદ કરવા માટે તસ્કરીથી પીડિત લોકો માટેના મદદ કાર્યક્રમ (**Support for Trafficked People Program**) માટે સરકાર નાણાકીય વ્યવસ્થા કરી આપે છે અને ઓસ્ટ્રેલિયન રેડ ક્રોસ (Australian Red Cross) તેને લોકો સુધી પહોંચાડે છે.

ઓસ્ટ્રેલિયામાં બીજી સેવાઓ છે જે મદદ કરી શકે છે.

1800RESPECT એ જાતીય સતામણી, ઘરેલુ અને પારિવારિક હિંસાનો ભોગ બનેલાઓને સલાહ આપતી ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્તરની સેવા છે (Australia's National Sexual Assault, Family and Domestic Violence Counselling service). તે મફત અને ખાનગી સલાહ અને માહિતી, ફોન પર અને ઓનલાઇન આપી શકે છે. સલાહ આપનાર તમારી વાતો સાંભળે, તમારા પ્રશ્નોના જવાબ આપી શકે અને તમારી નજીકના વિસ્તારમાં ઉપલબ્ધ બીજી મદદ કરતી સેવાઓ તરફ તમને દોરી શકે છે.

1800 737 732 પર ફોન કરો અથવા **1800RESPECT**ની વેબસાઇટ **www.1800RESPECT.org.au** પર જાઓ.

શું તમારે દુભાષિયાની જરૂર છે?

131 450 પર ભાષાંતર અને દુભાષિયા સેવા (**Translating and Interpreting Service**) (TIS) માટે ફોન કરો. TIS માંથી દુભાષિયો તમને બીજી સેવાઓ સાથે વાતચીત કરવામાં મદદ કરી શકે છે. જોકે, TIS સલાહ સૂચન કરતી નથી. બધા કોલ્સ મફત અને ખાનગી હોય છે.

ઓસ્ટ્રેલિયામાં માનવ તસ્કરી અને ગુલામી વિશે વધુ માહિતી:

Support for Trafficked People Program વિશે વધુ માહિતી માટે સામાજિક સેવા ખાતા (Department of Social Services) ની વેબસાઇટ **www.dss.gov.au** પર અથવા Australian Red Cross ની વેબસાઇટ **www.redcross.org.au** પર જાઓ. તમે Australian Red Cross ને **national_stpp@redcross.org.au** પર પણ ઇમેલ કરી શકો છો.

માનવ તસ્કરી અને ગુલામી બાબતે વધુ માહિતી માટે ગૃહ ખાતા (Department of Home Affairs) ની વેબસાઇટ **www.homeaffairs.gov.au** અથવા ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (Australian Federal Police) ની વેબસાઇટ **www.afp.gov.au** પર જાઓ અને "human trafficking (માનવ તસ્કરી)" શોધો.